

ત્વરિત જાહેરાત માટે

સમસ્ત ઉનાળા દરમિયાન ઉત્સવો અને ઈવેન્ટ્સની ભરમાર વચ્ચે બ્રેમ્પટનનો આનંદ ઉઠાવો

બ્રેમ્પટન, ઓન્ટારિયો (19 મે 2022) – સિટી ઓફ બ્રેમ્પટન આખા ઉનાળામાં સંપૂર્ણ પરિવાર માણી શકે એવા હરોળબંધ ઉત્સવો અને ઈવેન્ટ્સને આવકારશે. મે 20 થી સપ્ટેમ્બર 11 સુધી નિવાસીઓ અને મુલાકાતીઓને સમર ઈન દ સિટી માણવાનું આમંત્રણ પાઠવીએ છીએ; 114 દિવસની સિઝન જેમાં 100 દિવસના પ્રોગ્રામો સમાયેલા છે જેમાં સમાવેશ થાય છે:

- ઉત્સવો અને ઈવેન્ટ્સ જેમકે પ્રાઈડ 2022, રાષ્ટ્રીય આદિજાતિ લોક દિન (National Indigenous Peoples' Day) અને કેનેડા દિન;
- સમુદાય દ્વારા દોરેલ ઈવેન્ટ્સ જેમકે વર્લ્ડ ઓપ જાઝ અને વાઈબ્રન્ટ બ્રેમ્પટન;
- સાપ્તાહિક પ્રોગ્રામિંગ જેમકે લોકપ્રિય બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટ અને મૂવી નાઈટ્સ; અને
- બીજું ઘણું બધું!

સિટી ઓફ બ્રેમ્પટનની વિવિધતાને વધાવી લેવા, નાગરિક ગૌરવને પ્રોત્સાહિત કરવા, જાહેર જગ્યાઓને સક્રિય કરવા અને કલા તથા સંસ્કૃતિના દ્રશ્યમાન કરતા શહેરભરના રૂબરૂ થતા કાર્યક્રમોમાં નિવાસીઓ અને મુલાકાતીઓને આવકારવા માટે બ્રેમ્પટન ઉત્સાહિત છે.

સિટી ઓફ બ્રેમ્પટનનું ઈવેન્ટ્સ કેલેન્ડર ઉનાળાના ઈવેન્ટના આયોજન માટે જાણે વન-સ્ટોપ શોપ બની રહેશે. ઈવેન્ટ ઓર્ગનાઈઝરોને કેલેન્ડરમાં વિગતો ભરવાનું આમંત્રણ છે જેથી આખા શહેરમાં ઈવેન્ટ્સ હાથ ધરવા માટે પ્રોત્સાહન મળે. કેલેન્ડરમાં ઈવેન્ટ ઉમેરવા માટે અને તે જોવા કે શું થવાનું છે, અહીં મુલાકાત લો brampton.ca/events. આખા ઉનાળા દરમિયાન ઈવેન્ટ્સ ઉમેરાતા રહેશે.

સપોર્ટ લોકલ

ઈવેન્ટ માટે જ્યારે બ્રેમ્પટનમાં હોવ ત્યારે તેને માણી કેમ ન લેવો? બ્રેમ્પટન ફૂડ ગાઈડના પાના ઉથલાવો અને સ્થાનિક રેસ્તોરાને સપોર્ટ કરો. બ્રેમ્પટન વૈવિધ્યસભરના આખા વિશ્વના અનોખા સ્વાદ ઓફર કરે છે. આજે જ ગાઈડના પાના ઉથલાવો અને તમારી મનગમતી જગ્યા શોધી કાઢો. અહીં વધુ જાણકારી લો brampton.ca/tourism.

ડાઉનટાઉન પુનરુત્થાન

ડાઉનટાઉન બ્રેમ્પટન એક પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જેમા અગ્રેસર ભૂમિકા પીલ રિજનની છે જેથી વિસ્તારની વોટરમેઈન અને સેનિટરી ગટરો બદલી શકાય. તેના પરિણામે ઘણા બધા માર્ગો બંધ છે. કોઈ ઉત્સવ કે ઈવેન્ટ માટે તમે ડાઉનટાઉનમાં આવવાનું વિચારતા હોવ તો બરાબર પહેલેથી આયોજન કરશો.

નગરપાલિકાના પાર્કિંગ અપડેટ અહીં મળશે brampton.ca, અથવા ત્યાં પહોંચવા માટે બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો ઉપયોગ કરશો. આની મદદ લઈને પહેલેથી તમારી સફરનું આયોજન કરશો [ટ્રિપલિન્ક્સ \(Triplinx\)](http://Triplinx.com).

સુવાક્યો

"ઉનાળો હાથ વેંતમાં છે અને હું બધાને પ્રોત્સાહિત કરું છું કે બધા બહાર નીકળો અને અહીં બ્રેમ્પટનમાં થતા આટલા બધા ઉત્સવો અને ઈવેન્ટ્સનો લાભ લો અને ગમ્મત કરો. અમારા પરંપરાગત કેનેડા ડે ઈવેન્ટથી લઈને સાપ્તાહિક બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટ જુઓ તો દરેક જગ્યાએ બધા માટે કઈકને કઈક તો છે જ!"

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"અમે તો બધા જ આવા અંતહીન પ્રોગ્રામિંગ અંગે બહુ ઉત્સાહિત છીએ જે અમારા નાગરિકો અને મુલાકાતીઓ માટે આ ઉનાળે પ્લાન કર્યા છે જેથી બહાર નીકળીને બ્રેમ્પટનનો ખરો લહાવો લઈ શકાય. હું અમારા બધા સમુદાયના સહયોગીઓને ઈવેન્ટના કેલેન્ડરને ભરી કાઢવા પ્રોત્સાહિત કરું છું અને આ સિઝનમાં બ્રેમ્પટનના સમુદાયો આ સિઝનમાં શું શું માણી શકશે તેની જાણકારી બધા સાથે વહેંચે."

- હરકિરત સિંઘ, સિટી કાઉન્સિલર, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

"સિટી ઓફ બ્રેમ્પટન અને તેના સમાજના સહયોગીઓ પાસે રોમાંચક હોય એવા ઘણા બધા સમર પ્રોગ્રામિંગ કરવાની યોજનાઓ છે જે આખા શહેરના બધા જ લોકો માણી શકે. આ ઉનાળે જો જવા જેવી કોઈ જગ્યા હોય તો તે છે બ્રેમ્પટન જ્યાં ઓળખાણો થઈ શકશે, એક બીજા સાથે પ્રવૃત્ત થઈ શકાય અને ગમ્મત કરી શકાશે!"

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

मिडिया संपर्क (MEDIA CONTACT):

सीटी ओड् ब्रॅम्पटन मल्टिकल्चरल मिडिया

multiculturalmedia@brampton.ca